

અંતરશુદ્ધિનાં સોપાન

શ્રીગુરુમાર્ગ દ્વારા લિખિત પુસ્તકમાંથી

ઉદ્ધરણ ૩

દરેક શાસ્ત્ર જ્ઞાની પુરુષને ઊંચો દરજ્જો આપે છે. સિદ્ધયોગમાં આપણે જ્ઞાનની પૂજા કરીએ છીએ. ભગવાન સ્વયં જે વ્યક્તિ પોતાની અંદર જ્ઞાનને ધારણ કરે છે તેમની પ્રશંસા કરે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે :

યતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥

હે અર્જુન, ચાર પ્રકારના ગુણીજન મને ભજે છે :
જેઓ દુઃખી છે, જેઓ સંપત્તિની ઇચ્છા રાખે છે,
જેઓ જિજ્ઞાસુ છે અને જેઓ જ્ઞાની છે. (૭:૧૬)

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥

તેઓમાં, એ જ્ઞાની સર્વશ્રેષ્ઠ છે, જે સતત દઢ છે,
જે માત્ર પરમેશ્વરનો અનન્ય ભક્ત છે.
જે જ્ઞાનમાં ડૂબેલો છે તેને હું અત્યંત પ્રિય છું,
અને તે મને પ્રિય છે. (૭:૧૭)

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥

આ બધાં ભક્તો ખરેખર ઉદાર છે,
પરંતુ જ્ઞાનમાં ડૂબેલાને હું મારો જ આત્મા માનું છું.
જેનું મન દઢ છે તે મારામાં, પરમ લક્ષ્યમાં જ સ્થિત છે. (૭:૧૮)

તમારાં દૈનિક જીવનમાં પણ, શું તમે નથી જોયું કે જ્યારે તમને કોઈ સારી સલાહ આપે અથવા ઊંડી સમજની વાત કહે, ત્યારે તમારી અંદર અપાર કૃતજ્ઞતા અને સન્માનની લાગણી ઉભરાઈ આવે છે? ભલે તમે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હો અથવા જીવન કેટલું પણ મુશ્કેલ હોય, તમે એ સલાહને અપનાવવા માંગો છો.

અને તમે એ વ્યક્તિને સાથે જ પસંદ કરો છો. જો તમારી સાથે આમ બને છે, તો કલ્પના કરો કે ભગવાન એ વ્યક્તિને કેટલો પ્રેમ કરતા હશે જે પોતાની અંદર સાચા જ્ઞાનને ધારણ કરે છે અને ચોવીસે કલાક તેના પ્રતિ જાગ્રત રહે છે.

એક સાંજે એક વ્યક્તિ દર્શન સમયે આવી અને કહ્યું, “ગુરુમાઈ, હું એક અંધારી સુરંગમાંથી બહાર આવી ગયો છું. હવે મને ઘણું જ સારું લાગે છે.”

મેં મનોમન આ વ્યક્તિ જે ઘણા લાંબા સમયથી ગૂંચવાડામાં હતી તેનું ધ્યાન રાખવા માટે ઈશ્વરનો ધન્યવાદ માન્યો. અને પછી તરત જ તેણે કહ્યું, “પરંતુ મેં હજી સુધી નીલબિંદુનાં દર્શન નથી કર્યા.”

મેં તેના તરફ જોઈને કહ્યું, “તમારી મુશ્કેલીઓનો અંત થઈ ગયો છે; આ તો આભાર માનવાની વાત છે.”

“પરંતુ... પરંતુ મેં નીલબિંદુનાં દર્શન નથી કર્યા. આટલાં બધાં વર્ષો પછી પણ!” પછી તેણે કહ્યું, “હું નીલબિંદુનો કોર્સ લેવાનો છું.” તેણે અર્થપૂર્ણ રીતે, સીધું મારી આંખોમાં જોયું, આડકતરી રીતે સૂચવવા કે જ્યારે તે ત્યાં હોય ત્યારે સારું રહેશે કે નીલબિંદુ પણ ત્યાં હોય.



© ૨૦૨૨ એસ.વાય.ડી.એ. ફાઉન્ડેશન®. સર્વાધિકાર સુરક્ષિત.

ગુરુમાઈ ચિદ્વિલાસાનંદ, અંતરશુદ્ધિનાં સોપાન : દિવ્ય સદ્ગુણોનો યોગ, અધ્યાય ૪, ‘જ્ઞાનમાં દઢતા’માંથી (ચિત્શક્તિ પબ્લિકેશન્સ, ચેન્નઈ, ૨૦૧૩), પૃષ્ઠ ૫૦-૫૧.